

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨/૨/૨૦૧૫ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૨૨૩/૧૫

અસલ હીરા બતાવી વેપારીઓને વિશ્વાસમાં લઇ બનાવટી હીરા આપી લાખો રૂપિયાનો વિશ્વાસઘાત અને છેતરપીંઠી કરતા તેમજ આઠેક માસ અગાઉ આંગડીયા પેઢીના માણસ પાસેથી હીરાના પાર્સલના રૂપિયા ૮૦ લાખના મુદ્દામાલની ચીલઝડપ કરતી ગેંગ ના એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. કાઇમબ્રાન્ચ અમદાવાદ શહેર.

નાયબ પોલીસ કમિશ્નર શ્રી હિમાંશુ શુક્લા કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.સી.સોલંકી, એસઓજી કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.ડી.જાડેજા એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ મીલકત સંબધી બનેલ ગુના શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં પો.સ.ઇ. શ્રી વી.એચ.જાડેજા તથા પોસઇ શ્રી સી.બી.ગામીત નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ફરતા ફરતા કુષ્મણગર ચાર રસ્તા મહાકાળી મંદિર ની આજુબાજુ જાહેર રોડ ઉપર આવતા સાથેના હેડ કોન્સ. નારસિંહ રામસિંહ તથા પો.કો. નિશારઅહેમદ ઉસ્માનમીયાં નાઓએ આપેલ બાતમી હકીકત આધારે લક્ષ્મણ ઉર્ફે અકો S/O કેશાભાઇ જાતે મારવાડી ઉવ.૨૮ ધંધો:રીક્ષા ડ્રાઇવીંગ રહે, ખોડિયાર માતાનો વાસ, મ.નં.૪૪૬, ખોડિયારમાતાના મંદિર ની બાજુમાં, નહેરુનગરનાં છાપરાં, કુબેરનગર, અમદાવાદ શહેરનો મળી આવેલ. જેઓની પુછપરછ કરતાં તે પોતે તથા તથા વીરુભાઇ રત્નાભાઇ મારવાડી રહે, ઇન્દીરાબ્રીજ, એરપોર્ટ રોડ, રેકડી માતાના મંદિરની બાજુમાં છાપરામાં, અમદાવાદ તથા નારણભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા રહે, મ.નં.૦૩, આશારામ પાર્ક , સુભાષનગર, ઓમપ્રકાશ તિવારી હાઇસ્કુલ ની બાજુમાં, નોબલ ટર્નિંગ, કુબેરનગર, અમદાવાદ શહેર તથા કેશાભાઇ ઉકાજી મારવાડી રહે, બ્લોક નં.૧૨૧, સહકાર સોસાયટી, સેક્ટર-૨૫, ગાંધીનગર નાઓ મળી આજથી એકાદ માસ પહેલા એટલે કે તા.૦૮/૦૧/૨૦૧૫ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે સરસપુર નિર્મળપુરા ચાર રસ્તા પાસે આવેલ એસ.આર.પી. તંબુ પાસે શાહપુર હલીમની ખડકી પાસે આવેલ જ્વેલર્સની દુકાન ના માલિક ચંપકલાલ ને વિશ્વાસમાં લઇ પ્રથમ અસલ હીરા બતાવી રૂપિયા છ લાખમાં હીરા લેવાનું નક્કી કરી બાદમાં નક્કી થયા મુજબ રૂપિયા છ લાખ લઇ તેના બદલામાં

નકલી હીરા આપી છેતરપીંડી કરેલ હોવાનું તેમજ વધુ પુછપરછ કરતાં તે તથા વીરુભાઇ રત્નાભાઇ મારવાડી બંને જણાં આજથી આઠેક મહીના એટલે કે તા.૧૮/૦૪/૨૦૧૪ ના રોજ અગાઉની કરેલ રેકો મુજબ અમૃતલાલ માધવલાલ આંગડીયા પેઢી કે જે સરદારપટેલ ડાયમંડ માર્કેટ બાપુનગર ખાતે આવેલ છે તેના આંગડીયા પેઢીના બે માણસોનો તેઓએ પીછો કરી ને મણીદીપ ચેમ્બર, ઠક્કરનગર ચાર રસ્તા ખાતે રામદેવપીર ટ્રેડર્સ નામની દુકાન આગળ આંગડીયા પેઢીના માણસો પાસેથી તેઓએ થેલો ઝપટ મારી ગુંટવી લઇ તેઓ ભાગી ગયેલા જેમાં રૂપિયા ૭૯ લાખ ૫૮ હજારના પોલીશ્ડ તથા રફ હીરાના જુદી જુદી પેઢીઓના પાર્સલો હતા જે પાર્સલો તથા મોટર સાઇકલ વીરુ લઇને ત્યાંથી જતો રહેલ હોવાનું અને તેને ફક્ત અસલ હીરા નંગ-૬ તથા વાપરવા પૈસા આપેલ હોવાનું જણાવેલ. સદરી ઇસમની અંગઝડતી માંથી અસલ હીરા કિ.રૂ.૪૦,૦૦૦/- તથા નકલી હીરા કુલ્લે ૪૫૦ નંગ કિ.રૂ.૦૦/૦૦ ના મળી આવતા સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે. આ બનાવો બાબતે તપાસ કરતાં શહેરકોટડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩/૧૫ ધી ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦ મુજબ તથા નરોડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૦૭/૧૪ ધી ઇપીકો ૩૫૬, ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોવાની હકીકત જણાવેલ. જેથી આરોપીને આજરોજ તા.૦૨/૦૨/૧૫ ના કલાક ૧૨/૦૦ વાગે સીઆરપીસી કલમ ૪૧(૧) એ મુજબ અટક કરવામાં આવેલ. અને વધુ તપાસ અર્થે આરોપી તથા કાગળો નરોડા પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર  
પોલીસ કમિશનર વતી.